



RAN-2408000603020007

B.Com.(Sem.-III) Examination November - 2025 (MAJOR) Banking (Law & Practice) Paper : II

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) પ્રશ્ન 1 ફરજિયાત છે.
Question 1 is compulsory.
- (3) જમણી બાજુ લખેલ આંકડાઓ પ્રશ્નનાં પૂરા ગુણ દર્શાવે છે.
Figures to the right indicate full marks of the questions.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ)

10

Answer in short. (Any Five)

1. વસુલાત સંચાલનનો અર્થ લખો.
Write the meaning of recovery management.
2. 'તરુણ યોજના' એટલે શું?
What is 'Tarun Scheme'.
3. વખાર રસીદ નો અર્થ લખો.
Write the meaning of godown receipts.
4. માલગીરોની વ્યાખ્યા લખો.
Write the definition of Pledge.
5. બિન-ઉત્પાદકિય અસ્ક્યામતના પ્રકારો જણાવો.
State the types of non product Assets.
6. સુનિતિસંગત ગીરાની વ્યાખ્યા લખો.
Write the definition of Hypothecation.
7. રક્ષિત ધિરાણના લક્ષણોની યાદી આપો.
Give the list of characteristics of secured advance.

પ્ર.2. બેંકિંગ ઉદ્યોગમાં વસુલાત સંચાલનનું મહત્વ સવિસ્તાર સમજાવો.

14

Explain the importance of recovery management in Banking industries.

અથવા/OR

પ્ર.2. અ. બેંકો દ્વારા લેવાયેલા વિવિધ વસુલાત યોજનાના પરિણામની ચર્ચા કરો.

7

Discuss the results of various recovery schemes implemented by the Bank.

બ. મુદ્રા લોન યોજનાનો હેતુ સમજાવો.

7

Explain the objective of mudra loan.

પ્ર.3. વિવિધ જામીનગીરીઓના તારણ સામે ધિરાણ આપતી વખતે બેંકર તરીકે તમે કઈ સાવચેતીઓ રાખશો. 14

What kind of precautions will you take as a banker while making advance against Various securities.

અથવા/OR

- પ્ર.3. અ. પ્રધાનમંત્રી મુદ્રા લોન અંગે રાષ્ટ્રીયકૃત બેંકોની કામગીરી વિગતવાર સમજાવો. 7
Explain in detail about the Nationalised banks performance of PMMY.
- બ. બેંકિંગ વ્યવસાયમાં બાયંધરીનું મહત્વ સમજાવો. 7
Explain the importance of Guarantee in banking business.
- પ્ર.4. ટૂંક નોંધ લખો (કોઈ પણ ત્રણ) 12
Write short note. (Any Three)
1. હક્ક ગીરો.
Mortgage
 2. સરફેસી કાયદો-2002
SARFAESI Act-2002
 3. બાયંધરીનો અંત.
Ends of Guarantee.
 4. અરક્ષિત ધિરાણના જોખમો.
Risk of Unsecured advance.
 5. દેવાં વસુલાત ટ્રિબ્યુનલ.
Debt recovery Tribunal.
-